



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સંદર્ભ

એસેસમેન્ટ અને ટેક્ષ કલેક્શન ખાતુ
પૂર્વજોન

કચેરીનું સરનામુ :-

વિભાગીય ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી ,
શ્રી હરુભાઈ મહેતા ભવન,
વિરાટનગર ચાર રસ્તા,
અમદાવાદ.

ફોન :- ૦૭૯-૨૨૮૭૦૩૨૭
૦૭૯-૨૨૮૭૦૪૨૪

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૫
અંતર્ગત કલમ - ૪(૧) બી (૧) મુજબ
પ્રો-એક્ટીવ ડીસ્કલોઝર

વહીવટી માળખ

ડ.ભ્યુનિ.કમિશર (પૂર્વ જોન)



આસી.ભ્યુનિ.કમિશર (પૂર્વ જોન)



ડ.અસેસર અને ટેક્સ કલેક્ટર (પૂર્વ જોન)



આસી.મેનેજર



ડીવીઝનલ સુપ્રિ. (બીટ)



રખીયાલ

(૦૪૦૧ થી ૦૪૦૬)

અમરાઈવાડી

(૦૪૦૭ થી ૦૪૧૨)

ખોખરા

(૦૪૧૫,૦૪૧૭,૦૪૧૮)
(૦૪૩૮ થી ૦૪૪૩)

બાપુનગર

(૦૪૧૯ થી ૦૪૨૪)

ઓઢવ

(૦૪૨૫ થી ૦૪૩૨)

રામોલ-વસ્ત્રાલ

(૦૪૩૩ થી ૦૪૩૭)
(૦૪૪૪ થી ૦૪૪૯)

પૂર્વ ઝોન ,ટેક્સ વિભાગ કચેરીના અગત્યના ઝોન નંબરની વિગત

અનુ નં.	અધિકારીનું નામ	ઓફિસ	રહેઠાળ
૧	શ્રી મનીષભાઈ કે.ત્રિવેદી ડ.એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર અને અપીલ અધિકારીશ્રી પૂર્વ ઝોન ટેક્સ	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૩૨૭૦૩૮૬૮૮
૨	શ્રી પ્રણવ કંસારા આસી.મેનેજર અને જા. મા. અધિકારીશ્રી પ્રોડે. ટેક્સ, ગુમાસ્તાધારા	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૩૭૬૦૧૬૭૮૦
૩	શ્રી પ્રીતેશ શાહ આસી.મેનેજર અને જા. મા. અધિકારીશ્રી પૂર્વ ઝોન ટેક્સ	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૩૨૭૦૧૬૭૭૮
૪	શ્રી હરદેવસિંહ જાદવ આસી.મેનેજર અને જા. મા. અધિકારીશ્રી પૂર્વ ઝોન ટેક્સ	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૩૨૭૦૩૮૭૮૫
૫	શ્રી ડામોર દ્વાજભાઈ દીન્યાર્જ ડીવી.સુપ્રિ.શ્રી પૂર્વ ઝોન ટેક્સ (રખિયાલ બીટ) વોર્ડ નં. ૦૪૦૧ થી ૦૪૦૬	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૬૮૭૧૮૨૩૭૭
૬	શ્રી હિંકકુમાર એન. કટારા ડીવી.સુપ્રિ. શ્રી પૂર્વ ઝોન ટેક્સ (અમરાઈવાડી બીટ) વોર્ડ નં. ૦૪૦૭ થી ૦૪૧૨	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૮૨૫૭૭૮૦૪૨
૭	શ્રી પ્રતાપભાઈ રાઠવા ડીવી.સુપ્રિ. શ્રી પૂર્વ ઝોન ટેક્સ (ખોખરા બીટ)	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૮૮૨૫૦૬૧૮૭૦

	વોર્ડ નં. ૦૪૧૫, ૦૪૧૭ થી ૦૪૧૮, ૦૪૩૮ થી ૦૪૪૩		
૮	શ્રી રમેશભાઈ પારદી(દુન્યાજી) ડીવી.સુપ્રિ. શ્રી પૂર્વ જોન ટેક્સ (બાપુનગર બીટ) વોર્ડ નં. ૦૪૧૮ થી ૦૪૨૪	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૯૯૯૯૯૯૦૬૬૫
૯	શ્રી કમલેશભાઈ બારીયા ડીવી.સુપ્રિ. શ્રી પૂર્વ જોન ટેક્સ (ઓઢવ બીટ) વોર્ડ નં. ૦૪૨૫ થી ૦૪૩૨	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૯૮૨૫૮૬૮૪૩૧
૧૦	શ્રી ગુણુભાઈ વારલી ડીવી.સુપ્રિ. શ્રી પૂર્વ જોન ટેક્સ (રામોલ-વસ્ત્રાલ બીટ) વોર્ડ નં. ૦૪૩૩ થી ૦૪૩૭ અને ૪૪૪ થી ૦૪૪૮	૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૪	૯૪૨૬૦૨૦૭૩૪

પ્રો .ટેક્સ ના કર્મચારીઓની માહિતી

અનું નં.	કર્મચારીનું નામ	હોદ્દો	રિમાકર્સ
૧	શ્રી પ્રણાવ કંસારા	આસી. મેનેજર	-
૨	શ્રી રામસીગ ચૌધરી	ઓ.એસ.	-
૩	શ્રી મુકેશભાઈ છ. પટેલ	સીની. કલાર્ક	-
૪	શ્રી અરવિંદભાઈ સિસોદિયા	જુ.કલાર્ક	-
૫	શ્રી હર્ષદ એ ઠાકોર	જુ.કલાર્ક	-
૬	શ્રી શૈલાબેન શાહ	જુ. કલાર્ક	-
૭	શ્રી ગોવિંદભાઈ દાતણિયા	પટાવાળા	-

પૂર્વ ઝોન ટેક્સના કર્મચારીની માહિતી

અનું નં	કર્મચારીનું નામ	હોદ્દો	બીટ/વોર્ડ નંબર	રિમાકર્સ
૧	શ્રી મનીષભાઈ કે.ન્નિલેટી	ડે.એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર		
૨	શ્રી પ્રીતેશ શાહ	આસી.મેનેજર	બીટ-બાપુનગર, ઓઢવ, રામોલ-વસ્ત્રાલ	
૩	શ્રી હરદેવસિંહ જાદવ	આસી.મેનેજર	બીટ-રખિયાલ, અમરાઈવાડી, ખોખરા	
૪	શ્રી છગનભાઈ ડામોર (ઇન્યાજ)	ડીવી. સુપ્રિ.	બીટ - રખિયાલ	
૫	શ્રી રમેશભાઈ પારધી (ઇન્યાજ)	ડીવી. સુપ્રિ.	બીટ-બાપુનગર	
૬	શ્રી દિપકુમાર એન. કટારા	ડીવી. સુપ્રિ.	બીટ-અમરાઈવાડી	
૭	શ્રી રાઠવા પ્રતાપસિંહ	ડીવી. સુપ્રિ.	બીટ-ખોખરા	
૮	શ્રી કમલેશભાઈ બારીયા	ડીવી. સુપ્રિ.	બીટ-ઓઢવ	
૯	શ્રી ગુણુભાઈ વારલી	ડીવી. સુપ્રિ.	બીટ-રામોલ-વસ્ત્રાલ	
૧૦	શ્રી ભાવિનભાઈ ભોઈ	જુ. લીગલ આસીસ્ટન્ટ		
૧૧	શ્રી પ્રવિષભાઈ નિનામા	વો.ઈ	મીટરગેજ	વોર્ડ નં-૪૦૧
૧૨	શ્રી પ્રવિષભાઈ નિનામા	વો.ઈ	રખિયાલ ગામ	વોર્ડ નં-૪૦૨
૧૩	શ્રી ઉરમાનગની શેખ	વો.ઈ	હાથીભાઈ	વોર્ડ નં-૪૦૩
૧૪	શ્રી ઉરમાનગની શેખ	વો.ઈ	ગોમતીપુર ગામ	વોર્ડ નં-૪૦૪
૧૫	શ્રી કનકસિંહ ગોળ	વો.ઈ	શમશેરબાગ	વોર્ડ નં-૪૦૫
૧૬	શ્રી કનકસિંહ ગોળ	વો.ઈ	ઝુલતામીનારા	વોર્ડ નં-૪૦૬
૧૭	શ્રી દિલીપભાઈ રાણા	વો.ઈ	રોહિતમીલ સર્કલ	વોર્ડ નં-૪૦૭
૧૮	શ્રી પંજુમન ઉદાણી	વો.ઈ	ચકુંદિયા મહાદેવ	વોર્ડ નં-૪૦૮
૧૯	શ્રી વૈધ કનુભાઈ	વો.ઈ	અમરાઈવાડી ગામ	વોર્ડ નં-૪૦૯
૨૦	શ્રી વૈધ કનુભાઈ	વો.ઈ	સત્યમનગર	વોર્ડ નં-૪૧૦
૨૧	શ્રી જે.ડી. અલગોતર	વો.ઈ	ભીલવાસ	વોર્ડ નં-૪૧૧
૨૨	શ્રી નગીનભાઈ રાવળ	વો.ઈ	સોનીની ચાલી	વોર્ડ નં-૪૧૨
૨૩	શ્રી દેવાનંદ કે. ચારણ	વો.ઈ	લાલભાઈ સેન્ટર	વોર્ડ નં-૪૧૪
૨૪	શ્રી દેવાનંદ કે. ચારણ	વો.ઈ	જગદીશનગર	વોર્ડ નં-૪૧૭
૨૪	શ્રી શૈલેન્ડ સક્સેના	વો.ઈ	ગોરનો કુવો	વોર્ડ નં-૪૧૮

૨૬	શ્રી જે. ડી. અલગોતર	વો.ઈ	નવલખા	વોર્ડ નં-૪૧૮
૨૭	શ્રી દિલિપભાઈ પટેલ	વો.ઈ	હરદાસનગર	વોર્ડ નં-૪૨૦
૨૮	શ્રી પ્રવિષ્ણભાઈ ડામોર	વો.ઈ	નીલમ પાર્ક	વોર્ડ નં-૪૨૧
૨૯	શ્રી દિલિપભાઈ પટેલ	વો.ઈ	ઇન્દ્રાનગર	વોર્ડ નં-૪૨૨
૩૦	શ્રી નંદુભાઈ રાણા	વો.ઈ	જુનુ વિરાટનગર	વોર્ડ નં-૪૨૩
૩૧	શ્રી નંદુભાઈ રાણા	વો.ઈ	શાસ્ત્રી સ્ટેરિયમ	વોર્ડ નં-૪૨૪
૩૨	શ્રી હસમુખભાઈ પારેખ	વો.ઈ	નિકોલ	વોર્ડ નં-૪૨૫
૩૩	ભંવરસિંહ રાજપૂત	વો.ઈ	ખોડિયારનગર	વોર્ડ નં-૪૨૬
૩૪	શ્રી પ્રવીષ્ણભાઈ મહેતા	વો.ઈ	ઓઢવ ગામ	વોર્ડ નં-૪૨૭
૩૫	શ્રી કલ્યાણભાઈ મકવાણા	વો.ઈ	રબારી કોલોની	વોર્ડ નં-૪૨૮
૩૬	શ્રી રમેશભાઈ પારગી	વો.ઈ	જી.વી.એમ.એમ.	વોર્ડ નં-૪૨૯
૩૭	શ્રી મહેશ ઠક્કર	વો.ઈ	અબુદાનગર	વોર્ડ નં-૪૩૦
૩૮	શ્રી કલ્યાણભાઈ મકવાણા	વો.ઈ	જી.આઈ.ડી.સી.	વોર્ડ નં-૪૩૧
૩૯	શ્રી ઈન્દ્રસિંહ વિરપરા	વો.ઈ	નવા ઓઢવ	વોર્ડ નં-૪૩૨
૪૦	શ્રી કનુભાઈ પરમાર	વો.ઈ	વસ્ત્રાલ મહાદેવનગર	વોર્ડ નં-૪૩૩
૪૧	શ્રી કનુભાઈ પરમાર	વો.ઈ	વસ્ત્રાલ	વોર્ડ નં-૪૩૪
૪૨	શ્રી રતીલાલ પરમાર	વો.ઈ	વસ્ત્રાલ-૧	વોર્ડ નં-૪૩૫
૪૩	શ્રી સીરાજઅલી સૈયદ	વો.ઈ	રામોલ-૧	વોર્ડ નં-૪૩૬
૪૪	શ્રી વિનોદ પટેલ	વો.ઈ	રામોલ-૨	વોર્ડ નં-૪૩૭
૪૫	શ્રી નગીનભાઈ રાવલ	વો.ઈ	ગીતા ગૌરી	વોર્ડ નં-૪૩૮
૪૬	શ્રી નગીનભાઈ રાવલ	વો.ઈ	છોટાલાલની ચાલી	વોર્ડ નં-૪૩૯
૪૭	શ્રી પ્રતાપભાઈ રાઠવા	વો.ઈ	વટવા	વોર્ડ નં-૪૪૦
			જી.આઈ.ડી.સી., વિંઝોલ	
૪૮	શ્રી દેવાનંદ કે. ચારણ	વો.ઈ	હાથીજણ, ગેરતપુર	વોર્ડ નં-૪૪૧
૪૯	શ્રી શૈલેન્ડ્ર સક્સેના	વો.ઈ	કેડીલા, ઈસ્ટ	વોર્ડ નં-૪૪૨
૫૦	શ્રી શૈલેન્ડ્ર સક્સેના	વો.ઈ	વસ્ત્રાલ, ઈસ્ટ	વોર્ડ નં-૪૪૩
૫૧	શ્રી વિરલભાઈ પુરોહિત	વો.ઈ	નવા નરોડા-૧ ઈસ્ટ	વોર્ડ નં-૪૪૪
૫૨	શ્રી વિરલભાઈ પુરોહિત	વો.ઈ	નવા નરોડા-૨ ઈસ્ટ	વોર્ડ નં-૪૪૫
૫૩	શ્રી મનસુખભાઈ કોલિયા	વો.ઈ	નવા નિકોલ ઈસ્ટ	વોર્ડ નં-૪૪૬
૫૪	શ્રી વિરલભાઈ પુરોહિત	વો.ઈ	શુંકન ચાર રસ્તા	વોર્ડ નં-૪૪૭
૫૫	શ્રી વિનોદ પટેલ	વો.ઈ	બેટી બચાવો મેદાન	વોર્ડ નં-૪૪૮
૫૬	શ્રી રવીન્દ્રભાઈ યાદવ	વો.ઈ	કઠવાડા રોડ	વોર્ડ નં-૪૪૯
૫૭	શ્રી વિનોદભાઈ શાહ	સીની. કલાર્ક	આર.ડી.આઈ અને વહીવટી બાબતો	
૫૮	શ્રી ચંદ્રકાન્ત સંઘવી	સીની. કલાર્ક	કેશવાન	
૫૯	શ્રી કે. કે. ડામોર	સીની. કલાર્ક		ફાળવણી પૂર્વજોન વહીવટ
૬૦	શ્રી કનુભાઈ જી. પટેલ	સીની. કલાર્ક		ફાળવણી પૂર્વજોન વહીવટ
૬૧	શ્રી જુમાના વકીલ	સીની. કલાર્ક		ફાળવણી પૂર્વજોન વહીવટ
૬૨	શ્રી સંધ્યાબેન કિશ્ચિયન	સીની. કલાર્ક	વહીવટી કામગીરી	

૬૩	શ્રી રાકેશ શાહ	સિનિ. કલાર્ક	કેશવાન	
૬૪	શ્રી લલિત બોરીચા	જુ. કલાર્ક	બીલ કલાર્ક	
૬૫	શ્રી અંકિતભાઈ કાનડે	જુ. કલાર્ક	ઇન્વર્ડ કલાર્ક	
૬૬	શ્રી રોનકબેન વી.શાહ	જુ. કલાર્ક	કન્ટીજન્સી કલાર્ક	
૬૭	શ્રી ગીતા પી. પટેલ	જુ. કલાર્ક	ઇન્વર્ડ કલાર્ક	
૬૮	શ્રી ચેતનભાઈ ખમાર	સીની કલાર્ક	વહીવટી કામગીરી	
૬૯	શ્રી પારુલબેન ચૌહાણ	જુ. કલાર્ક	ઇન્વર્ડ કલાર્ક	
૭૦	શ્રી હેતલબેન જાદવ	જુ. કલાર્ક	એમ.આઈ.એસ ની કામગીરી	
૭૧	શ્રી ભીખાભાઈ છ.વાળા	લુહાર		
૭૨	શ્રી કમલેશકુમાર એચ. શાહ	પટાવાળા		
૭૩	ભરવાડ રણજિત કે.	પટાવાળા		
૭૪	ગોસ્વામી સૂર્યપરબત ડી.	પટાવાળા		
૭૫	બ્રહ્મભટ મહેન્દ્રભાઈ	પટાવાળા		
૭૬	શ્રી યજેશ ડી. પટેલ	પટાવાળા		
૭૭	શ્રી સુરેશ આર. પાંચનેકર	પટાવાળા		
૭૮	શ્રી મહેશભાઈ ગોહેલ	પટાવાળા		

કરદાતાઓ તરફથી આવતી નીચે મુજબની અરજીઓનો નિકાલ ટેક્ષ ખાતા દ્વારા કરવામાં આવે છે :

- મિલકતની માલિકીના નામ ટ્રાન્સફર અને મિલકતના કબજેદારના નામમાં ફેરફાર કરવા.
- બી. પી. એમ. સી. એકટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરકૃયુલર નં. ૧૪ મુજબવપરાશના પ્રકારના ઘોરણે મિલકતની આકારણી ઘટાડવા અંગે.
- એકજ મિલકતના બે બિલઆવતા હોય તો વધારાના બિલ રદ કરવા અથવા સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તો વપરાશના ઘોરણે જુદા જુદા બિલ કરવા અંગે.
- મિલકતખાલી/બિનવપરાશઅંગે નોંધ રાખી ખાલી મિલકતો ટેક્ષ રીફંડ મેળવવા.
- નવી મિલકતનું એસેસમેન્ટ કે જૂની મીલકતોનો વપરાશ બદલાયો હોય, ભાડાના દરમાં ફેરફાર થયો હોય તો આકારણી રીવાઈઝ કરવા અંગે.
- ખુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ આપવો.
- ચતુર્વધીય આકારણીના વર્ષે જાહેરનામાની મુદ્દતમાં પૂરાવા સાથે વાંધા અરજીઓ સ્વીકારી એપેલેટ ખાતા દ્વારા તેનો પૂરાવાના આધારે, સ્થળ તપાસ કરી નિકાલ કરવામાં આવે છે.

નવી મિલકતોની આકારણી અથવા આકારણી રીવાઈઝ કરવા માટે

નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર ભાડુઆતના ઘોરણે વપરાશ કરવામાં આવતો હોય તેમજ વપરાશમાં ફેરફાર થયેલ હોય તો આકારણી રીવાઈઝ કરાવવા માટે ખુનિસિપલ કોર્પોરેશને નકટી કરેલ ફોર્મમાં અરજી સાથે-

- (૧) રહેઠાણ માટે :- મિલકતના માલિકીના પૂરાવાની પ્રમાણિત નકલ, જમીન માલિકીનો ૭/૧ રનો ઉતારો, ઓર્જનાઈઝર પાસેથી કબજોમેળવ્યો હોય તો તેની કબજા પહોંચની પ્રમાણિતનકલ, રેશનકાર્ડ, ગેસ કનેક્શનના પૂરાવા તથા
- (૨) બિન રહેઠાણ માટે :- ગુમાસ્તાધારનું લાઈસન્સ, સેલ્સ ટેક્ષ રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ, ઈલેક્ટ્રિકિસ્ટી, ટેલિફોનનું બિલ રજૂ કરવા.

જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ કરાવવા માટે

જૂની મિલકત જમીનદોસ્ત ક્યારે થઈ તેના પૂરાવા, જૂની મિલકત તોડી પાડ્યા અંગેની અરજી આપેલ હોય તો તેની પહોંચની ઝેરોક્ષ, નવી મિલકત બાંધવા અંગે ખાનની વિગત, બી.યુ.પરમીશન ક્યારે આપવામાં આવી છે તેની વિગત, નવી મિલકતની આકારણી ટેક્સખાતા દ્વારા ક્યા વર્ષથી કરવામાં આવી છે તેની વિગત, રદ કરવાના બિલોની ઝેરોક્ષ નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

સમગ્ર મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તેના બીલ જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્સના બિલ મેળવવા માટે, અરજીફોર્મ સાથે બિલની પ્રમાણિત નકલ, ભાડુઆત તાબે મિલકતના ભાડાના પૂરાવામાં ભાડા પહોંચ, ભાડા કરારની પ્રમાણિત નકલ રજૂ કરવી.

મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

અરજુફોર્મ સાથે જૂના ભાડુઆત મિલકત ખાલી કરી ગયાનો પુરાવો / કબજો / સોઘાનો પત્ર / કબજાકરારની નકલ, ભાડુઆતખાલી કરી ગયા અંગે અમીાવીભૂનિસિપલ કોપોરેશનનેજાણ કર્યા અંગેઅગાઉઅરજ કાર્ડની નકલ, પ્રોપટી ટેક્ષના છેલ્લા બિલની નકલ સામેલ રાખી નિયત ફોર્મમાં અરજ કરવાની છે.

મિલકત ખાલી / બીન વપરાશ (નોન યુઝ) અંગેની નોંધ રાખવા માટે

અરજ સાથે પ્રોપટી ટેક્ષના બિલની નકલ રજૂ કરવી જે તે નાણાંકીયવર્ષમાં મિલકત ત૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી હશે તો મિલકતવેરાની રકમ મજરે મળી શકશે નહીં. જે દિવસે અરજ આપવામાં આવી હશે તે તારીખથી ખાલીનો લાભમળી શકશે. દરેક નાણાંકીય વર્ષમાં મિલકત ખાલી રહેવાની હોય તો નાણાંકીય વર્ષ ની શરૂઆતમાં અગાઉથી અરજ કરવાની છે. નાણાંકીય વર્ષ ના અંતે ખાલીનો લાભ આપવામાં આવે છે.

ભૂનિસિપલ વેલ્યુએશન અપીલના ચુકાદાનો અમલ કરવા માટે

ભૂનિસિપલ વેલ્યુએશન અપીલના ચુકાદાની પ્રમાણિત નકલ રજૂ કરવી. છેલ્લા બિલની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજ કરવાની હોય છે.

એક જ મિલકતના બે બિલ આવતાં હોય તો વધારાનું બિલ રદ કરવા બાબત

અરજ સાથે ચાલુ બિલ તથા રદ કરવાનાં બિલની પ્રમાણિત નકલ સામેલ કરી નિયત ફોર્મમાં અરજ કરવાનીહોય છે.

બી.પી.એમ.સી.એક્ટની કલમ ૪૮૫ / ૧, રુલ-૨૦ તથા સરક્યુલર નં.૧૪ મુજબ મિલકતની આકારણી ઘટાડવા માટે

માલિક તાબે વપરાશ હોય તો મિલકતના માલીક તરીકેના પુરાવામાં મિલકત ખરીદીનો દસ્તાવેજ, .૭/૧૨ નો ઉતારો, ઈન્દેક્ષ ની નકલ, સોસાયટીના ઠરાવની નકલ, પાવર ઓફ એટનીની નકલ, વેચાણ કરારની નકલ, કબજા કરાર તથા નાણાં ચુકવ્યાના પુરાવાની પ્રમાણિત નકલ, સામેલ કરવી. ભાડુઆત મિલકત ખાલી કરી ગયા હોય અને મિલકતનો માલિક તાબે વપરાશ હોય તો ભાડુઆત ખાલી કરી ગયાંગેની નોંધ થઈ ગઈ હોય પરંતુ આકારણીમાં સુધારો ન થયો હોય તો ‘ સેલ્ફ ’ અંગેની નોંધ થઈગઈ હોય પરંતુ આકારણીમાં સુધારો ન થયો હોય તો ‘ સેલ્ફ ’ કર્યાના જાવક કાર્ડની નકલ, ટેક્ષ બિલની નકલ સાથે નિયત ફોર્મમાં અરજ કરવાની હોયછે.

મિલકતના નામ ટ્રાન્સફર માટે

અરજ સાથે નામ ફેર માટે સિટી સર્વેની ઓફિસમાં રાખવામાં આવતા રેકર્ડ ઓફ રાઇટ્સની એન્ટ્રીની પ્રમાણિત નકલ, જો મિલકત રજીસ્ટર્ડ કો.ઓ. ડા. સોસાયટીમાં હોય તો વારસાઈના કિસ્સામાં સોસાયટીના ઠરાવ અને શેર ટ્રાન્સફરના ઠરાવની ચેરમેન અથવા સેકેટરીની સહી સિક્કાવાળી પ્રમાણિત નકલ, અથવા કન્વેયન્સ ડીડની પ્રમાણિત નકલ, રજીસ્ટર્ડ દસ્તાવેજ અથવા ઈન્દેક્ષની નકલ રજૂ કરવી જરૂરી છે.આ મિલકતનો અરજ કર્યા તારીખસુધીનો પુરોપુરો તમામ ટેક્ષ ભરી પહોંચની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજ કરવાની છે.

તત્કાળ નામ ટ્રાન્સફર સ્કીમ અનુસાર પૂરતા પુરાવા રજુ થયેથી દર સોમવાર, બુધવાર તથા શુક્રવારના રોજ ચાલુ કામકાજના દિવસોએ સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ દરમ્યાન નામ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે.

ક્રમાંકનં. ૨ થી ૧૦ના દરેક ફોર્મની કિંમત રૂ. ૨-૦૦ રાખવામાં આવેલ છે.

જાહેરનામાના અનુસંધાનમાં મ્યુનિસિપલ મિલકત વેરાની આકારણી અંગે વાંધા અરજી કરવા માટે

દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્ષના બિલ ઈસ્યૂ કરતાં પહેલાં જાહેર જનતા પોતાની મિલકતની આકારણી કેટલી છે તેજાણી શકે તે માટે ૧૫ દિવસ સુધી એસેસમેન્ટ રજિસ્ટરો જોવા માટેની જાહેરાત બે વર્તમાનપત્રોમાં કરવામાં આવે છે. નાગરિકો વિના મૂલ્યે આવી નોંધ જોઈ શકે છે. તેનો ઊતારો કરી શકે છે અને નોંધ કે આકારણી સામે કોઈ વાંધો હોય તો પુરાવા સાથે નિયત ફોર્મમાં નિયત સમય મર્યાદામાં અરજી કરી શકે છે. વાંધા અરજીના નિકાલ માટે એપેલેટ ઓફિસર જરૂરિયાતના સમયે સ્થળ તપાસ કરે છે તથા અરજદાર કે તેમના પ્રતિનિધિને રૂબરૂ રજૂઆત કરવા સાંભળવા માટે બોલવે છે. તે સમયે પુરાવા રજૂ કરવાના હોય છે. રજૂઆતની નોંધ હ.૨.૬ (હરકત રજીસ્ટર ઠરાવ) રજીસ્ટરમાં જે તે વ્યક્તિની હાજરીમાં કરવામાં આવે છે. અરજદાર પુરાવા રજૂ કરવા માટે જરૂર હોય તો એક મુદ્દત પણ મેળવી શકે છે. એપેલેટ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો આવો હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર સ્મોલ કોર્ટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશકાય છે. બિલ સામે ફરિયાદ કરી શકતી નથી.

ખાસ નોટિસ સામેની વાંધા અરજી અંગે

હ્યાત મિલકતમાં કોઈ વધારાના બાંધકામના સમયે કે મિલકતનો વપરાશ માલિક તાબેથી ભાડુઆત તાબે થાય કે રહેઠાણમાંથી બીન રહેઠાણમાં વપરાશ બદલાવવાના લીધે ચાલતીઆકારણી વધારવાના સમયે કારણોની વિગત સાથે મિલકત ધારકને ખાસ નોટિસ આપવામાં આવે છે. સદરહુ નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં વાંધાના કારણો - પુરાવા સાથે વાંધા અરજીકરી શકાય છે. અને આવી વાંધા અરજીનો નિકાલ જાહેર નામાના સંદર્ભમાં કરવામાં આવેલ વાંધા અરજીના નિકાલની જેમ જ એપેલેટ ઓફિસર દ્વારા કરવામાં આવે છે.

મિલકતના વપરાશ / પુનઃ વપરાશ સમયે કરવાની ફરજીયાત જાણા :

કોઈપણ નવી મિલકત કે જૂની બંધ મિલકતનો પુનઃ વપરાશ શરૂ કર્યાના ૧૫ દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ.પી.એમ.સી. એકટના પરિશિષ્ટ એ ના પ્રકારણ- ૮ના રૂલ ૫ હેઠળ જાણ કરવી ફરજીયાત છે. નિયત કરવામાં આવેલ રીકવીઝીશન ફોર્મ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોનલ કચેરીઓના ટક્ષ વિભાગમાંથી વિના મૂલ્યે મળી શકશે. સમય મર્યાદામાં મિલકતના વપરાશ કે મિલકતમાં થયેલ વધારાના બાંધકામ, બદલાયેલા ઉપયોગના પ્રકાર કે ભાડુઆત અંગે જાણ કરવામાં ન આવે તો આવી મિલકતોની આકારણી ટેક્ષ ખાતા દ્વારા પુરાવાના અભાવે કરવામાં આવે છે, અને જ.પી.એમ.સી. એકટ પરિશિષ્ટ - એ ના પ્રકારણ - ૮ના રૂલ ૮ (૩)ની જોગવાઈ મુજબ આવી આકારણી સામે વાંધો લેવાનો મિલકતના માલિક અથવા ભોગવટો કરનારને પ્રતિબંધ નડશે.

નોંધ:- પ્રોપર્ટી ટેક્સને લગતી કોઈ પણ ફરિયાદીના ફોર્મ વિરાટનગર સીટી સીવીક સેન્ટર વિરાટનગર ચાર રસ્તા અથવા કોઈ પણ સીટી સીવીક સેન્ટર ખાતેથી મેળવી જરૂરી વિગત ભરી નિયમાનુસાર ટેક્ષ ભરી માન્ય પુરાવાઓ સામેલ કરી સીટી સીવીક સેન્ટરમાં આપવાની રહેશે.

અરજુનિકાલની સમય મર્યાદા

તમામ પૂરાવાઓ અરજુ સાથેઆપેલા હોય અને નવીગણતરી મુજબ પૂરેપૂરો ટેક્ષ ભરપાઈ કરવામાં આવેલ હોય તો અરજુનો નીચે જણાવેલ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવશે.

અનુ. નંબર	અરજુનો પ્રકાર	અરજુના નિકાલની સમય મર્યાદા
૧	બી.પી.એમ.સી.એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ઘટાડવા બાબત	૧ માસ
૨	નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર તો જૂની મિલકત ભાડુઆત પાસેથી કરવામાં આવેલ ભાડાના વધારાને લઈ તેમજ વપરાશ ફેરફાર થયેલ હોઈ આકારણી રીવાઈઝ કરવા.	૧ માસ
૩	મિલકતના કબજેદારમાં ફેરફાર કરવા બાબત.	૧૫ દિવસ
૪	મિલકતના ઉપયોગના પ્રકારમાં ફેરફાર.	૧૫ દિવસ
૫	જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ કરવા	૧ માસ
૬	સમગ્ર મિલકતનું એક બિલ આવે છે તેના બદલે જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્ષ બિલ આપવા બાબત.	૧ માસ
૭	એક જ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાનું બિલ રદ કરવા બાબત.	૧ માસ
૮	મિલકતના નામ ટ્રાન્સફર માટે ૧૫ દિવસ	૧૫ દિવસ
૯	અન્ય-સામાન્ય અરજુઓ	૧૫ દિવસ
૧૦	મિલકત ખાલી / નોન યુઝ અંગે.	વર્ષ પુરું થયા બાદ ૩૦ એપ્રિલ સુધી
૧૧	મ્યુ.વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ લેવા અંગે.	૧૫ દિવસ

ઉપરોક્ત પ્રકારની અરજુઓના નિકાલ માટેની લઘુતમ સમય મર્યાદા ખાતા દ્વારા નિયત કરવામાં આવેલ છે. જો ઉપરોક્ત સમય મર્યાદામાં અરજુનો નિકાલ ન થાય તો સંબંધિત ઝોનનાં ટેચ્યુટી એસેસર એન્ડ ટેક્સ કલેક્ટરનો કામકાજના દિવસોએ ૩-૦૦થી ૫-૦૦ માં રૂબરૂ સંપર્ક કરવો. બિલમાં નામ/ સરનામાં (સ્પેલ્લિંગ) અંગેની ભૂલ માટે પૂરાવા સાથે સાદા કાગળ ઉપર અરજુ કરવાથી તે અંગેનો નિકાલ કરવામાં આવશે.

આવી અરજુઓ કરવા જાહેર જનતાની અનુકૂળતા માટે ખૂબજ નજીવી કિંમતે છાપેલા ફોર્મ દફ્તર વિભાગ તથા દરેક ઝોન તથા દરેક સીવીક સેન્ટર ઉપરથી નાગરિકોને ઓફિસ સમયે વેચાણ આપવામાં આવે છે. કરદાતાઓની સગવડતા માટે કોઈપણ ઝોનના કરદાતા નીચે જણાવેલ કોઈપણ સીટી સિવિક સેન્ટર ઉપર મિલકતવેરો અને મ્યુનિસિપલ આલ્યુવન વાહનવેરો ભરી શકે તેમજ કોઈપણ ઝોનની અરજુ આપી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. નીચે મુજબના કેશ કલેક્શન કાઉન્ટરો રાખવામાં આવેલ છે.

પૂર્વ ઝોન -- સીટી સીવીક સેન્ટર

અ.નં	સેન્ટર	સરનામુ	ફોન	સમય
૧	વિરાટનગર	શ્રી હરભાઈ મહેતા ભવન, વિરાટનગર ચાર રસ્તા, બાપુનગર, અમદાવાદ	૩૨૮૮૯૨૪૩	સવારે ૮:૩૦ થી સાંજે ૭:૩૦ સુધી
૨	ઓઢવ	ઓઢવ વોર્ડ ઓફિસ, રબારી વસાહત નજીક, ઓઢવ ફાયર સ્ટેશનની બાજુમાં, ઓઢવ, અમદાવાદ		સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૩	અબુર્દાનગર	કવિ રમણલાલ વસંતલાલ દેસાઈ લાયબ્રેરી બિલ્ડિંગ, કૃષ્ણપાર્ક ટયુબવેલની બાજુમાં, સુખનાન ગાર્ડનની નજીક, હિન્દુસ્તાન માર્બલ રોડ, નિકોલ, અમદાવાદ	૨૨૭૦૦૧૬૦	સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૪	અમરાઈવાડી	અમરાઈવાડી સબજોનલ ઓફિસ, મથુર માસ્ટર ચાર રસ્તા નજીક, ૧૩૨ કુટ રીગરોડ, અમરાઈવાડી, અમદાવાદ	૨૨૭૪૨૮૩૮	સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૫	મહાવીરનગર	મહાવીરનગર વોર્ડ ઓફિસ, જુના એ. એમ. ટી. એસ. એપોની અંદર, એકતા એપા.ની સામે, હાટકેશ્વર-સી.ટી.એમ. રોડ, અમદાવાદ	૨૫૮૫૨૫૪૪	સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૬	રાજપુર	રાજપુર સબજોનલ ઓફિસ, ચકુડીયા મહાદેવ નજીક, બળીયાકાકા રોડ, રાજપુર, અમદાવાદ	૨૨૭૪૦૨૦૫	સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૭	ગોમતીપુર	ગોમતીપુર વોર્ડ ઓફિસ, ગોમતીપુર રેફરલ હોસ્પિટલ નજીક, મ્યુ. બાલભવન, ગોમતીપુર દરવાજાની સામે, અમદાવાદ	૨૨૭૪૦૭૬૬	સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી
૮	વસ્ત્રાલ	વસ્ત્રાલ વોર્ડ ઓફિસ, અજય ટેનામેન્ટ વિ.-પની બાજુમાં, આર. ટી. ઓ. ઓફિસની સામે, નાની કેનાલ નજીક, વસ્ત્રાલ રોડ, મહાદેવનગર, અમદાવાદ		સવારે ૮:૩૦ થી સાંજે ૪:૩૦ સુધી

આ સેન્ટર ઉપર કેડીટ કાર્ડથી પણ નાણાં સ્વીકારવામાં આવે છે.

આર.ટી.આઈ. એક્ટ અન્વયે પૂર્વ ઓન - પ્રોપરી ટેક્ષ વિભાગની માહિતી

જાહેર માહિતી અધિકારીશ્રી	<p>આસી.મેનેજર</p> <p>(૧) પ્રીતેશ શાહ વોર્ડ નંબર : ૦૪૧૯ થી ૦૪૩૭ અને ૦૪૪૪ થી ૦૪૪૮ ફોન નંબર : ૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૨</p> <p>(૨) હરટેવસિંહ જાદવ વોર્ડ નંબર : ૦૪૦૧ થી ૦૪૧૨,૦૪૧૫,૦૪૧૭ થી ૦૪૧૮ અને ૦૪૩૮ થી ૦૪૪૩ ફોન નંબર : ૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૨</p>
જે-તે બીટના ટેક્ષ માહિતી અંગેના અપીલ અધિકારીશ્રી	<p>ઢ.એસેસર અને ટેક્ષ કલેક્ટર (પૂર્વ ઝોન)</p> <p>શ્રી મનીષકુમાર કે. ત્રિવેદી</p> <p>ફોન નંબર : ૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૨</p>
સમગ્ર ટેક્ષ, પૂર્વ ઝોન જાહેર માહિતી અધિકારીશ્રી	<p>ઢ.એસેસર અને ટેક્ષ કલેક્ટર (પૂર્વ ઝોન)</p> <p>શ્રી મનીષકુમાર કે. ત્રિવેદી</p> <p>ફોન નંબર : ૦૭૯-૨૨૮૭૦૩૨૭ ૦૭૯-૨૨૮૭૦૪૨૨</p>

